

**ખહેરાત****એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહિતી - ૨૦૨૦-૨૧**

(હકત સરકારી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ધોરણ - ૫ માં ભણતા આદિજાતિના બાળકો માટે ) આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સ્વાથે સ્વાસ્થ્ય આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો કાર્યરત છે. સદર શાળાઓ ધોરણ-૬ થી ધોરણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ , રમતગમત , ચિત્રકલા , શિક્ષણ , લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. આ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલોમાં ધોરણ-૬ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉત્તમકક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામાં પ્રવેશ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટેલેન્ટપુલ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં પ્રથમ તબક્કે ઉત્તીર્ણ થવાનું રહેશે. (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકાર શ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નિયમો ધ્યાને લેવામાં આવશે.)

**પાત્રતાનું ધોરણ :-**

- વિદ્યાર્થી / વિદ્યાર્થીની અનુસુચિત જનજાતિ ( ST ) હોવા ખેઇએ. તેની ઉંમર પ્રવેશ સમયે વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી ખેઇએ.
- વિદ્યાર્થી / વિદ્યાર્થીની સરકારી શાળા / આશ્રમશાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ( શિક્ષણ વિભાગની યાદી મુજબ ) ધોરણ - ૫ માં અભ્યાસ કરતા હોવા ખેઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ - ૫ પાસ કરેલ હોવું ખેઇએ.
- એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ શાળાઓમાં ક્રમાનુસાર કુલ બેઠકના ૫% બેઠક (૧) વિકલાંગ (૨) અનાથ(૩) પીવિટીલ (૪) હળપતી માટે બેઠક અનામત રાખવામાં આવશે.
- અનુ સુચિત જન જાતિ સિવાયના ઇ.એમ.આર.એસ. શાળાના કર્મચારીઓના બાળકો , વિધવા માતાના બાળકો અને અપંગ માતા-પિતાના બાળકો વગેરે વિદ્યાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે. લાગુ પડતા જરૂરી પ્રમાણપત્ર કાઉન્સેલીંગ સમયે રજૂ કરવાનું રહેશે.
- રપોર્ટર્સ ક્વોટા અંતર્ગત લાયક અનુસુચિત જનજાતિ વિદ્યાર્થીઓ કે જે રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ૨૦% બેઠકો સુધી પ્રવેશ આપવામાં આવશે. (લઘા કક્ષાએ , રાજ્ય કક્ષાએ તથા નેશનલ કક્ષાએ વિજેતા હોય - અગ્રિમતા આપવામાં આવશે). કાઉન્સેલીંગ સમયે જરૂરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

પ્રવેશ અરજીપત્ર મેળવવાના રથળો :

|                                    |   |
|------------------------------------|---|
| ★ સંબંધિત ગામની પ્રાથમિક શાળા      | ★ તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલો                   |
| ★ તમામ ગ્રામ પંચાયત                | ★ તમામ આદર્શ નિવાસી શાળાઓ/આશ્રમ શાળાઓ                     |
| ★ તમામ જી.એલ.આર.એસ. / મોડેલ સ્કૂલો | ★ પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનિશ કમિશ્નરશ્રીની કચેરીઓ  |
| ★ સરકારી પ્રાથમિક શાળાઓ            | ★ તમામ પરીક્ષા કેન્દ્રો તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી |

પ્રવેશ અરજીપત્ર જમા કરાવવાના રથળો :

- અરજીપત્ર ભરીને જે પરીક્ષાકેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાનું રહેશે. અને તે જ રથળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઈસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાએ અરજીપત્ર મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
- પરીક્ષા દરમિયાન પાત્રતા ઘરાવતા હોવાના કોઇ દરતાવેલ પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જે ઉમેદવારો પ્રવેશ માટે કરોટીના અંતે લાયક હરશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. જે ઉમેદવારો મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારો દરતાવેલ પુરાવા તે સમયે રજૂ કરવાના રહેશે. જેથી ઉમેદવારને પોતે ઠરાવેલ પાત્રતા ઘરાવે છે તેની ખરાઇ કરીને જ અરજી કરવા જણાવવામાં આવશે. પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જે પાત્રતા ઘરાવતા નહીં હોય તો કોઇ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પરીક્ષા પદ્ધતિ :

- **પરીક્ષા તા. ૧૬/૦૨/૨૦૨૦ ને રવિવાર** ના રોજ યોજવામાં આવશે , અને વિદ્યાર્થીઓએ **સવારે ૧૦:૩૦ કલાકે** પરીક્ષા રથળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય **સવારના ૧૧.૩૦ થી બપોરના ૨.૦૦ કલાક** સુધીનો રહેશે પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા (અંગ્રેજી અને ગુજરાતી), વિજ્ઞાન, અને ગણિત તથા સામાન્ય જ્ઞાન , બુદ્ધિમત્તા અને વ્યવહારને લગતા વિષયોમાંથી વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે પ્રશ્ન પત્ર લખવા માટેનો કુલ સમય ૨ કલાક અને ૩૦ મિનિટ નો રહેશે.
- પરીક્ષા ઓ.એમ.આર (OMR) પદ્ધતિથી લેવામાં આવશે.

**અગત્યની તારીખો :**

- ★ અરજીપત્ર મેળવવાની તારીખ **૨૭ ડીસેમ્બર-૨૦૧૯** થી
- ★ અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : **૧૭-જાન્યુઆરી-૨૦૨૦ (સાંજે ૬.૦૦ વાગ્યા સુધી)**
- ★ પરીક્ષાની તારીખ **૧૬ ફેબ્રુઆરી-૨૦૨૦ (રવિવાર)**
- ★ પરિણામ ખહેર કરવાની તારીખ : **મે ૨૦૨૦**

અરજીપત્ર ભરવાની બાબતમાં ખે કોઇ વિદ્યાર્થીઓને મૂશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો.

- વિના મૂલ્યે હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૭૮૨૮
- અમારી વેબસાઇટ [www.eklavya-education.gujarat.gov.in](http://www.eklavya-education.gujarat.gov.in)
- સંબંધિત જિલ્લા પ્રાયોજના કચેરી અને નજીકની ઇ.એમ.આર.એસ./જી.એલ.આર.એસ./મોડેલ શાળા

રથળ : ગાંધીનગર , તારીખ ૨૭/૧૨/૨૦૧૯

કાર્યપાલક નિયામક , જી.એસ.ટી..ઈ.એસ.